

بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ

બશાઈરુલ ખૈરાત

મુસન્નિફ

સચ્ચિદુના શૈખ અબ્દુલકાદિર ખુલાની ગૌષે પાક



નાશિર

હાજી ઘબાહીમભાઈ વડીયાવાલા

મોહસિને આઝમ મિશન

કિર્તીકુંજ સોસાયટી

શાહેઆલમ ટોલનાકા

અહમદાબાદ

(ગુજરાત)



بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ

બશાઈરુલ ખૈરાત

મુસન્નિફ

સચ્ચિદુના શૈખ અબ્દુલકાદિર ખુલાની

ગૌસે આઝમ દસ્તગીર رَضِيَ اللهُ تَعَالَى عَنْهُ

તરજમા ઓર પુસ્તક રીડિંગ

હાજી ઇબ્રાહીમભાઈ વડીયાવાલા

ટાઇપ સેટિંગ

જનાબ તૌફીક અહમદ અશરફી (બજૌદા)

સિને ઇશાયત

2025 (પાંચવી બાર)

તઅદાદ

1000

હદિયા

દુઆએ ખૈર

મિલનેકા પતા

મકતબએ શૈખુલ-ઇસ્લામ, અલિફ કિરાણાકે સામને

રસૂલાબાદ, શાહે આલમ, અહમદાબાદ-૨૮

ઓર મોહસિને આઝમ મિશનકી તમામ બાન્યેં

કોન્ટક્ટ : 96 24 22 12 12

بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ

إِنَّ اللَّهَ وَمَلَائِكَتَهُ يُصَلُّونَ عَلَى النَّبِيِّ يَا أَيُّهَا الَّذِينَ
آمَنُوا صَلُّوا عَلَيْهِ وَسَلِّمُوا تَسْلِيمًا ۝



કા-લલ્લાહુ-તબારક-વ-તઆલા-ફી-શાની-
હબીબિહિલ-કરીમ

ઇન્નલ્લાહ-વ-મલાઇકતહુ-યુસલ્લૂન-અલન્નબિય્યિ-યા
અય્યુહલ્લમીન-આમનૂ-સલ્લૂ-અલ્લેહિ-
વ-સલ્લિમૂ-તસ્લીમા ૦



તર્જમા

“બેશક ! અલ્લાહ પાક અને તેના તમામ ફિરિશ્તાઓ
દુરુદ મોકલે છે, તે ગૈબ બતાવનાર (નબી) ઊપર, એ ઈમાન
વાલાઓ ! તેમના ઊપર દુરુદ અને ખૂબ સલામ મોકલો.”

(કન્ઝુલ ઈમાન)

સલ્લલ્લાહુ-અલન-નબિય્યી-ઉમ્મિય્યિલ-કરીમ-વ-આલિહી-
સલ્લલ્લાહુ-તઆલા-અલયહિ-વસલ્લિમ-સલાતંવ-વ-
સલામન-અલયક યા રસૂલલ્લાહ !

મહબ્બતે રસૂલ જાને ઇમાન

لَا يُؤْمِنُ أَحَدُكُمْ حَتَّىٰ
أَكُونَ أَحَبَّ إِلَيْهِ مِنْ وَاَلِدَيْهِ
وَإِلِدَيْهِ وَالنَّاسِ أَجْمَعِينَ ۝

લા-યુઅમિનુ-અહદુકુમ-હતા-અકૂન-
અહબ્બ-ઇલૈહિ-મિન-વલદિહી-વ-
વાલિદિહી-વન્નાસિ-અજમઈન ૦

તર્જમા

“હઝરતે અનસ રَضِيَ اللهُ تَعَالَى عَنْهُ થી રિવાયત છે કે હુઝૂરે અકફરસ صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ ઈરશાદ ફરમાવે છે કે તમારા માંથી કોઈ પણ શખ્સ ત્યાં સુધી મુસલમાન નથી થઈ શકતો જ્યાં સુધી તે પોતાની ઔલાદ, માં-બાપ અને બાકીના તમામ લોકો થી વધીને મારાથી મહબ્બત ન કરતો હોય.”

(બુખારી, મુસ્લિમ, અહમદ, તિર્મિઝી, નિસાઈ અને ઇબ્ને માજા)

તમારા જેવો ખૂબ સૂરત કોઈ નથી

وَ أَحْسَنُ مِنْكَ لَمْ تَرَ قَطُّ عَيْنِي

وَ أَجْمَلُ مِنْكَ لَمْ تَلِدِ النِّسَاءُ

خُلِقَتْ مُبْرَأً مِّنْ كُلِّ عَيْبٍ

كَأَنَّكَ قَدْ خُلِقْتَ كَمَا تَشَاءُ

વ-અહસનુ-મિન્કા-લમ-તરા-કતુ-ઐની

વ-અજમલુ-મિન્કા-લમ-તલિદિન-નિસાઉ

ખુલિકત-મુબ્રાઅન-મિન-કુલ્લિ-ઐબિન

ક-અન્નક-કદ-ખુલિકત-કમા-તશાઉ

તર્જમા

“બેશક ! આપનાથી વધીને ખૂબ સૂરત શખ્સ મારી આંખોંએ કદી જોયો જ નથી અને આપના થી વધીને સૌદર્યવાન ને કદી કોઈ સ્ત્રીએ જન્મ નથી આપ્યો, આપ દરેક ખામી થી એવા પાક અને સાફ છો કે જાણે તમો તમારી ઈચ્છા મુજબ જ જન્મયા છો”

اممان كى ابارت

صيفه كوئى هو، مثل قرآن هو نهى سكتا
مناق كو كبهى، احساس اىماں هو نهى سكتا

نه هو تعظيم جس كے دل ميں سركار مدينه كى
عبادت لاکھ وه كر لے مسلمان هو نهى سكتا

سڀىڳا كوئى ڳو، وول ميسله كوراں ڳو نهى سكتا
موناڳىك كو كلمى، اهل ساسه ڳماں ڳو نهى سكتا
ن ڳو تا'جم جس ڳل مں سركاره مڳىنا كى
ڳباڳل لاه وول كر له، موسلمان ڳو نهى سكتا

اممان كى جان

الله كى سرتابه قدم شان هيں به  قرآن تو ايمان بتاتا هے انهيں
ان سانهيں انسان وه انسان هيں به  ايمان به كهتا هے ميرى جان هيں به

اڳلاڳ كى سر-تا-ا كڳم شان هڻ بهڳ
ڳن سا نهى ڳن-ساں، وول ڳن-سان هڻ بهڳ
كورآن تو ڳمان بااتاا هے ڳن-هڻ
ڳمان بهڳ كڳتا هے ميري جان هڻ بهڳ

(اڳ : ڳمامه ڳشكو مڳباا "اڳمڳ رڳا اريلاوى")

દુરુદ શરીફ ની ફઝીલત

“હઝરતે ઉબય ઈબને કા’બ رَضِيَ اللهُ تَعَالَى عَنْهُ રિવાયત કરે છે

કે :- એક વખત મેં હુઝૂરે અકદસ صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ થી અર્ઝ કરી કે યા રસૂલલ્લાહ ! હું આપના ઊપર વધૂ સંખ્યામા દુરુદ શરીફ પઢવા ઈચ્છુ છું. આપ સુચન કરો કે મેં મારા માટે દુઆ કરવા માટે જેટલો સમય નક્કી કર્યો છે, તેમાંથી કેટલો સમય આપના ઊપર દુરુદ મોકલવા માટે નિયુક્ત કરું ? આપે ફરમાવ્યું કે જેટલી તમારા મનની ઈચ્છા હોય, મેં અર્ઝ કરી કે શું ચૌથો (૧/૪) ભાગ નક્કી કરું ? આપે ફરમાવ્યું કે જેટલું તમારૂ મન ચાહે અને જો તેનાથી વધુ સમય ફાળવો તો તમારા માટે ઉત્તમ છે. મેં અર્ઝ કરી કે અરધો (૧/૨) સમય નક્કી કરું ? આપે ફરમાવ્યું કે જેટલું તમારૂ મન ચાહે અને જો તેનાથી વધુ સમય ફાળવો તો તમારા માટે ઉત્તમ છે. મેં અર્ઝ કર્યું કે તો પછી બે-તૃત્યાંસ (૨/૩) સમય નક્કી કરું છુ આપે ફરમાવ્યું કે જેટલું તમારૂ મન ચાહે અને જો તેનાથી વધુ સમય ફાળવો તો તમારા માટે ઉત્તમ છે. મેં અર્ઝ કરતા કહ્યું કે ઠીક છે, તો હવે હું મારી દુઆનો બધો સમય આપના ઊપર દુરુદ મોકલવા માટે નક્કી કરું છું, આપ صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ ફરમાવ્યું કે આ તમારા દીન અને દુન્યાના તમામ મક્સદો પૂરા કરવા માટે કાફી છે અને તમારા ગુનાહોં માફ થઈ જશે.” (હવાલો :- તિર્મિઝી શરીફ)

બશાઈરુલ ખૈરાત ની ફઝીલત

તમામ પ્રસંશા તે મહાન અલ્લાહ તબારક વ તઆલા માટે છે, જેણે ઈમાનની અમુલ્ય દૌલત આપણને અર્પણ ફરમાવીને આપણા ઊપર મહાન ઉપકાર કર્યો અને દરેક પળ અને દરેક ક્ષણ દુરુદો સલામ સરવરે દો જહાં, મુખ્તારે કુલ નબી صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ ઊપર અને આપના પવિત્ર વંશ અને બધા નિષ્ઠાવાન સાથીઓ ઊપર.

શૈખુલ ઉમ્મત, ઈમામુલ અઈમ્મા, તમામ વલિયોના સરદાર, કુત્બુલ અક્તાબ, ગૌસુલ આ'ઝમ હઝરતે સચ્ચિદુના અબ્દુલ કાદિર જીલાની બગદાદી رَضِيَ اللهُ تَعَالَى عَنْهُ એ આપની મહેફીલમાં કાયમી ઘોરણે બેસનારા નિ:સ્વાર્થ અનુયાયીઓ થી ફરમાવ્યું કે મારા થી તે દુરુદ લો (શીખો) જે મેં ઈલ્હામ (પ્રેરણા) દ્વારા અલ્લાહ પાક થી મેળવ્યું છે. મેં આ મુબારક દુરુદ શરીફ ને નબિય્યે કરીમ સરવરે કાઈનાત صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ ની બારગાહે આલીમાં પેશ કરીને એવો ઈરાદો કર્યો કે હુઝૂરે અકદસ صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ થી આ દુરુદ શરીફની ફઝીલત જાણું..પણ..મારો સવાલ હું પૂછું, તે પહેલા જ આપે ઈરશાદ ફરમાવ્યો કે આ દુરુદની ઘણી ફઝીલત છે. જેની ગણતરી કરવી અશક્ય છે. (અમુક ફઝીલતોં અહીં રજૂ કરવામાં આવે છે)

★ આ દુરુદ શરીફ પઢનારના દરજજાઓ બુલન્દ થાય છે અને તેના તમામ જાઈઝ મક્સદો પૂરા થાય છે .

★ આ દુરુદ શરીફ પઢીને જે પણ જાઈઝ મક્સદનો ઈરાદો કરશે, તે કદી રદ નહીં થાય અને નિરાશા નહીં સાંપડે અને તેનો વિસ્વાસ કદી પણ નહીં ડગમગે અને તેની દુઆ કબૂલ થશે.

★ જે શખ્સ આ દુરુદ શરીફ પઢશે, ભલે ફક્ત એક વખત જ પઢે અથવા આ દુરુદ અદબની સાથે ઉંચકીને ચાલે, તો અલ્લાહ પાક તેને અને તેની મજલિસમાં જે પણ ઉપસ્થિત હશે, તે બધાને પોતાના ફઝ્લો કરમ થી બખ્શી દેશે.

★ આ દુરુદ શરીફ હમેશા નિયમિત પઢનારની મૌતનો સમય જ્યારે પણ આવશે, ત્યારે તેની પાસે ચાર ફિરિશ્તા આવશે, પહેલો ફિરિશ્તો તેની પાસે શૈતાનને આવતા રોકી દેશે. બીજો ફિરિશ્તો તેને કલમએ શહાદતની તલ્કીન કરશે એટલે કે શિખવશે. ત્રીજો ફિરિશ્તો તેને જામે કૌસર પીવડાવશે. ચોથો ફિરિશ્તાના હાથમાં સોનાનું વાસણ હશે, જેમા જન્નતના ફળો હશે, તે ફિરિશ્તો તેને જન્નતના તે સ્થળની બશારત (ખુશ ખબરી) આપશે અને કહેશે કે ઐ અલ્લાહના બન્દા ! ખુશ થઈ જા ! તે જન્નતમા તારું સ્થાન તારી સગી આંખે તારી રૂહ નિકળતા પહેલાં જોઈ લીધું તે શખ્સ પોતાની કબ્રમાં એકદમ નિરાંત, આનંદ અને ખુશીની સાથે દાખિલ થશે, તેને કબ્રની તંગી અને કષ્ટનો ભય નહીં લાગે. તેની કબ્રમાં રહેમતના ચાલીસ દરવાઝાઓ ખોલી નાખવામાં આવશે, ઉપરાંત નૂર અને રૌશનીના દરવાઝાઓ પણ ખોલી નાખવામાં આવશે અને તેની કબ્ર નૂર થી ઝળહળી ઉઠશે. (ઈન્શાઅલ્લાહ)

કોના માટે આ બધું છે ?

રિવાયત

હુઝૂરે અકદસ રહમતે આલમ صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ થી

રિવાયત કરવામાં આવ્યું છે કે :-

“જ્યારે આપે મે’રાજની રાત્રે આસ્માનો, જન્નત, અર્શ વગેરેની સૈર ફરમાવીને અલ્લાહ પાક ની સમીપતા પ્રાપ્ત કરી, ત્યારે અલ્લાહ પાકે પુછ્યું કે ઐ મહબૂબ ! આ ધરતી કોની છે ? હુઝૂરે અકદસ صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ જવાબમાં અર્ઝ કરી કે ઐ રબ ! તારા માટે છે, ફરી સવાલ થયો, ઐ મહબૂબ ! આ હિજાબાત (પદાઓ / ભેદો) કોના માટે છે ? જવાબમાં અર્ઝ કરતાં કહ્યું કે ઐ રબ ! આ તારા માટે છે, ફરી અલ્લાહ પાકે સવાલ પુછ્યો કે કુર્સી કોના માટે છે ? ત્યારે હુઝૂરે અકદસ صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ મેં પોતાના સર મુબારકને સજદામાં ઝુકાવી દીધો અને વિશેષ કંઈ કહેવામાં અદબના શિષ્ટાચારે બોલવાથી અટકી ગયા, તે વખતે ખુદ અલ્લાહ પાકે ઈરશાદ ફરમાવ્યો કે ઐ મહબૂબ ! તૂ તેના માટે છે, જે તારા ઊપર દુરૂદ મોકલે છે અને તારી અઝમત અને બુઝુર્ગીને વધારે છે.”

બશાઈરુલ ખૈરાત

ની તિલાવત કરતાં પહેલા આ દુઆ પઢવી.

بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ

اللَّهُمَّ إِنِّي نَوَيْتُ بِصَلَاتِي عَلَى النَّبِيِّ

صَلَاةً عَلَيْكَ اللَّهُمَّ وَتَعْظِيمًا

لِنَبِيِّكَ سَيِّدِنَا مُحَمَّدٍ صَلَاةً عَلَيْكَ

فَتَقَبَّلْهَا مِنِّي بِفَضْلِكَ وَاحْسَانِكَ

وَازِلْ حِجَابَ الْغَفْلَةِ عَن قَلْبِي

وَاجْعَلْنِي مِنْ عِبَادِكَ الصَّالِحِينَ 0

અલ્લા
હુમ્મ-ઘન્ની-નવયતુ-
બિ-સલાતી-અલન્નબિય્યિ

صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ ધમ્તિસાલન-લિ-

અમરિ-ક-વ-તઅ-ઝીમન-લિ-નબિય્યિ-

ક-સય્યિદિના-મુહમ્મદિન صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ

ફ-તકબલ-હા-મિન્ની-બિ-ફદ-લિક-વ-

ઘહ-સાનિ-ક-વ-અઝિલ-હિજબલ-

ગફ-લતિ અન-કલ્બી-વજ-અલ્ની-

મિન-ઘબાદિક્-સાલિહીન ૦

તર્જમા

“ઐ અલ્લાહ પાક ! મેં નબિય્યે કરીમ صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ

ઊપર દુરુદ મોકલવાની નિયત તારા હુકમને અનૂસરીને અને

અમારા સરદાર હઝરતે સય્યિદુના મુહમ્મદ صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ

ની તા’ઝીમ માટે કરી છે. ઐ અલ્લાહ પાક ! તારા ફઝ્લ અને

અહેસાનથી મારાતરફથી કબૂલ ફરમાવ અને મારા દિલ ઊપરથી

ગફલતના પદ્મો હટાવીને મને તારા નેક બન્દાઓમાં થી

બનાવી દે.” (આમીન યા રબ્બલ આલમીન !)



बिस्मिल्लाहिर्रहमानिर्रहीम

الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ

अल-हम्दु-लिल्लाहि रब्बिल-आ-लमीन

اللَّهُمَّ صَلِّ وَسَلِّمْ عَلَى سَيِّدِنَا مُحَمَّدٍ

إِلْبَشِيرِ الْمُبَشِّرِ لِلْمُؤْمِنِينَ بِمَا قَالَ

اللَّهُ الْعَظِيمُ : ○ وَأَنَّ اللَّهَ لَا يُضِيعُ

أَجْرَ الْمُؤْمِنِينَ ○

अल्लाहुम्मा-सल्लि-व-सल्लिम-अला-
सय्यिदिना-मुहम्मदि-निल-अशीरिल-मु-
अशिशरि-लिल-मुअमिनीन-बिमा-डा-
लल्लाहुल-अमीमु-व-अशिशरिल-
मुअमिनीन ○ व-अण्णल्लाह-ला-युदीउ-
अज-रल मुअमिनीन ○

तर्जमा

“अै अल्लाड पाक ! डभारे सरदार डजरत सय्यिदुना मुहम्मद صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ पर दुइद भेज, जो मुअमिनोँ के लिये पुश भबरी देने और पडुंयाने वाले हैं. जैसा के अजमत वाले अल्लाड पाक का धरशाद है के ० “और धमान वालों के पुश भबरी दो” ० “और भेशक ! अल्लाड पाक नेकोँ का भदला जाभे नहीँ करता ०”

اللَّهُمَّ صَلِّ وَسَلِّمْ عَلَى سَيِّدِنَا مُحَمَّدٍ الْبَشِيرِ

الْمُبَشِّرِ لِلَّذَا كَرِينُ بِمَا قَالَ اللهُ الْعَظِيمُ :

فَاذْكُرُونِي اَذْكُرْكُمْ ۝ اذْكُرُوا اللهَ ذِكْرًا كَثِيرًا ۝

وَسَبِّحُوهُ بُكْرَةً وَّاَصِيْلًا ۝ هُوَ الَّذِي يُصَلِّيْ عَلَيْكُمْ

وَمَلَئِكْتُهُ لِيُخْرِجَكُمْ مِّنَ الظُّلُمَاتِ اِلَى النُّوْرِ ۝

كَانَ بِالْمُؤْمِنِيْنَ رَحِيْمًا ۝ تَحِيَّتُهُمْ يَوْمَ يَلْقَوْنَهُ

سَلَامٌ وَّاَعَدَّ لَهُمْ اَجْرًا كَرِيْمًا ۝

भहुत याद करो और सुब्छो शाम उस की पाकी भोलो”
 ० “वोछी है के दुरद भेजता है तुम पर वोछ और उस के
 किरिश्ते के तुम्हें अन्धेरियों से उजाले की तरफ निकालें और
 वोछ मुसलमानों पर महेरभान है” ० “उन के लिये मिलते
 वक्त की दुआ सलाम हैं और उन के लिये धरूअत का सवाभ
 तय्यार रभा है ०”

اللَّهُمَّ صَلِّ وَسَلِّمْ عَلَى سَيِّدِنَا مُحَمَّدٍ الْبَشِيرِ

الْمُبَشِّرِ لِلْعَامِلِينَ بِمَا قَالَ اللَّهُ الْعَظِيمُ :

أَنْتِ لَا أُضِيعُ عَمَلٍ عَامِلٍ مِنْكُمْ مِنْ ذَكَرٍ أَوْ

أَنْتِ ۝ وَبِمَا قَالَ : ۝ وَمَنْ عَمِلَ صَالِحًا مِنْ

ذَكَرٍ أَوْ أَنْتِ وَهُوَ مُؤْمِنٌ فَأُولَئِكَ يَدْخُلُونَ

الْجَنَّةَ يُرْزَقُونَ فِيهَا بِغَيْرِ حِسَابٍ ۝

અલ્લા
 હુમ્મ-સલ્લિ-વ-
 સલ્લિમ-અલા-સય્યિદિના-
 મુહમ્મદિ-નિલ-બશીરિલ-મુબશ્શિરિ
 લિલ-આમિલીન-બિમા-કા-લલ્લાહુલ-
 અઝીમ : અન્ની-લા-ઉદીઉ-અમલ-
 આમિલીમ-મિન્કુમ-મિન-ઝકરિન-અવ-
 ઉન્સા-વ-બિમા-કાલ : વ-મન-અમિલ-
 સાલિહન-મિન-ઝકરિન-અવ-ઉન્સા-વ-
 હુવ-મોમિનુન-ફ-ઉલાઘક-યદ
 ખુલૂનલ-જન્નત-યુરઝકૂન-
 ફીહા-બિગૈરિ-હિસાબ ૦

તર્જમા

“ઐ અલ્લાહ પાક ! હમારે સરદાર હઝરતે સય્યિદુના મુહમ્મદ ﷺ પર દુરૂદ ભેજ, જો અમલ કરને વાલોં કો ખુશ ખબરી દેને વાલે હૈ, જૈસા કે અઝમત વાલે અલ્લાહ પાક કા ઈરશાદ હૈ કે ૦ “મૈં તુમ મેં કામ કરને વાલે કી મહેનત અકારત નહીં કરતા મદ હો યા ઔરત” ૦ “ઔર જો અચ્છા કામ કરે મદ ખ્વાહ ઔરત ઔર હો મુસલમાન તો વોહ જન્નત મેં દાખિલ કિયે જાએંગે વહાં બે ગિનતી રિઝ્ક પાએંગે ૦”

اَللّٰهُمَّ صَلِّ وَسَلِّمْ عَلٰى سَيِّدِنَا مُحَمَّدٍ

اَلْبَشِيْرِ الْمُبَشِّرِ لِلاَّوَابِيْنِ بِمَا قَالَ اللهُ

اَلْعَظِيْمُ : فَاِنَّهٗ كَانَ لِلاَّوَابِيْنِ غَفُوْرًا ۝

لَهُمْ مَا يَشَاءُوْنَ عِنْدَ رَبِّهِمْ ذٰلِكَ جَزَاؤُ

اَلْمُحْسِنِيْنَ ۝

અલ્લાહુમ્મ-સલ્લિ-વ-સલ્લિમ-અલા-
સચ્ચિદિના-મુહમ્મદિનિલ-બશીરિલ-
મુબશ્શિરિલ-અવ્વાબીન-બિમા-કા-
લલ્લાહુલ-અમ્મીમુ : ફ-ઇન્નહુ-કાન-લિલ
અવ્વાબીન-ગફૂર ૦ લહુમ-મા-યશાઉન-
ઇન્દ-રબ્બિહિમ-ઝાલિક-જઝાઉલ-
મુહ-સિનીન ૦

तर्जमा

“अै अल्लाह पाक ! हमारे सरदार हजरते सय्यिदुना मुहम्मद صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ पर दुरद भेज, जो तौबा करने वालों को पुश भबरी देने वाले हैं, जैसा के अजमत वाले अल्लाह पाक का ँरशाह है के ० “तो भेशक ! वोह तौबा करने वालों को भप्शने वाला है” ० “उन के दिये है जो वोह याहे अपने रब के पास नेकों का येही सिवा (भदला) है ०”

اللَّهُمَّ صَلِّ وَسَلِّمْ عَلَى سَيِّدِنَا مُحَمَّدٍ الْبَشِيرِ

الْمُبَشِّرِ لِلتَّوَابِينَ بِمَا قَالَ اللَّهُ الْعَظِيمُ :

إِنَّ اللَّهَ يُحِبُّ التَّوَابِينَ وَيُحِبُّ الْمُتَطَهِّرِينَ ०

وَهُوَ الَّذِي يَقْبَلُ التَّوْبَةَ عَنْ عِبَادِهِ

وَيَعْفُو عَنِ السَّيِّئَاتِ ०

અલ્લા
હુમ્મ-સલ્લિ-વ-
સલ્લિમ-અલા-સચ્ચિદિના-
મુહમ્મદિનિલ-બશીરિલ-મુબશ્શિરિ-
લિતવ્વાબીન-બિમા-કા-લલ્લાહુલ-
અઝીમ : ઇન્નલ્લાહ યુહિબ્બુતવ્વાબીન-
વ-યુહિબ્બુલ-મુત-તહિહરીન ૦ વ-
હુવલ્લાઝી-ચક-બલુતૌબત-અન-
ઇબાદિહિ-વ-ચઅ-ફૂ-
અનિસ્સચ્ચિઆતિ ૦

તર્જમા

“ઐ અલ્લાહ પાક ! હમારે સરદાર હઝરતે સચ્ચિદુના મુહમ્મદ ﷺ પર દુરુદ ભેજ, જો બહુત તૌબા કરને વાલોં કો ખુશ ખબરી દેને વાલે હૈં, જૈસા કે અઝમત વાલે અલ્લાહ પાક કા ઈરશાદ હૈ કે ૦ “બેશક ! અલ્લાહ પાક પસન્દ રખતા હૈ, બહુત તૌબા કરને વાલોં કો ઓર પસન્દ રખતા હૈ સુથરોં કો” ૦ “ઔર વોહી હૈ જો અપને બન્દોં કી તૌબા કબૂલ ફરમાતા હૈ ઔર ગુનાહોં સે દર ગુઝર ફરમાતા હૈ.”

اللَّهُمَّ صَلِّ وَسَلِّمْ عَلَى سَيِّدِنَا مُحَمَّدٍ

الْبَشِيرِ الْمُبَشِّرِ لِلْمُخْلِصِينَ بِمَا قَالَ اللَّهُ

الْعَظِيمُ : فَمَنْ كَانَ يَرْجُو الْإِقَاءَ رَبِّهِ

فَلْيَعْمَلْ عَمَلًا صَالِحًا وَلَا يُشْرِكْ بِعِبَادَةِ

رَبِّهِ أَحَدًا ○ مُخْلِصِينَ لَهُ الدِّينَ ○

अल्लाहुम्म-सल्लि-व-सल्लिम-अला-
सय्यिदिना-मुहम्मदिनिल अशीरिल-
मुअशिरि-लिल-मुज्लिसीन-अिमा-डा-
लल्लाहुल अमीम : इ-मन-डान-यरजू-
लिकाअ-रज्जिही-इल-यअ-मल-अमलन-
सालिहंव-पला-युश-रिड-अिधआदति-
रज्जिही-अहदा ○ मुज्लिसीन-लहुदीन ○

तर्जमा

“अै अल्लाह पाक ! हमारे सरदार हजरते सय्यिदुना मुहम्मद ﷺ पर दुरुद भेज, जो मुज्लिसों के लिये भुश भबरी देने वाले हैं, जैसा के अजमत वाले अल्लाह पाक का ँरशाह है के ० “तो जिसे अपने रब से मिलने की उम्मीद हो, उसे याहिये के नेक काम करे और अपने रब की बन्दगी में किसी को शरीक न करे” ० “निरे उस के बन्दे हो कर ०”

اللَّهُمَّ صَلِّ وَسَلِّمْ عَلَى سَيِّدِنَا مُحَمَّدٍ

إِلْبَشِيرِ الْمُبَشِّرِ لِلْمُصَلِّينَ بِمَا قَالَ اللَّهُ

الْعَظِيمُ: ۞ وَأَقِمِ الصَّلَاةَ إِنَّ الصَّلَاةَ

تَنْهَى عَنِ الْفَحْشَاءِ وَالْمُنْكَرِ ۝ أَقِمِ

الصَّلَاةَ وَأْمُرْ بِالْعُرْفِ وَإِنَّهُ عَنِ

الْمُنْكَرِ وَاصْبِرْ عَلَىٰ مَا أَصَابَكَ إِنَّ ذَٰلِكَ

مِنْ عَزْمِ الْأُمُورِ ۝

અલ્લા
હુમ્મ-સલ્લિ-વ
સલ્લિમ-અલા-સય્યિદિના-
મુહમ્મદિનિલ-બશીરિલ-મુબશ્શિરિ-
લિલ-મુસલ્લીન-બિમા-કા-લલ્લાહુલ-
અઝીમ : વ-અકિમુસ્સલાહ ◦
ઇન્નસ્સલાત-તન્હા-અનિલ-ફહશાઘ-વલ-
મુન્કર ◦ અકિમિસ્સલાત વઅ-મુર-બિલ
મઅરફિ-વન્હા-અનિલ-મુન્કરિ-
વસ્બિર-અલા-મા-અસાબકા-
ઇન્ના-ઝાલિકા-મિન-અઝ
મિલ-ઉમૂર ◦

તર્જમા

“ઐ અલ્લાહ પાક ! હમારે સરદાર હઝરતે સય્યિદુના મુહમ્મદ ﷺ પર દુરૂદ ભેજ, જો નમાઝ પઢને વાલોં કો ખુશ ખબરી દેને વાલે હૈં, જૈસા કે અઝમત વાલે અલ્લાહ પાક કા ઈરશાદ હૈ કે ◦ “ઔર નમાઝ કાઈમ રખ” ◦ “બેશક ! નમાઝ મન્અ કરતી હૈ બે હયાઈ ઔર બુરી બાત સે” ◦ “નમાઝ કાઈમ રખ ઔર અચ્છી બાત કા હુકમ દે ઔર બુરી બાત સે મન્અ કર ઔર જો ઉફ્તાદ (મુસીબત) તુઝ પર પળે, ઉસ પર સબ્ર કર. બેશક ! યેહ હિમ્મત કે કામ હૈ ◦”

اَللّٰهُمَّ صَلِّ وَسَلِّمْ عَلٰى سَيِّدِنَا مُحَمَّدٍ

اَلْبَشِيْرِ الْمُبَشِّرِ لِلْخٰشِعِيْنَ بِمَا قَال

اَللّٰهُ الْعَظِيْمُ : ۝ وَاسْتَعِيْنُوْا بِالصَّبْرِ

وَالصَّلٰوةِ وَاِنَّهَا لَكَبِيْرَةٌ اِلَّا عَلٰى الْخٰشِعِيْنَ

اَلَّذِيْنَ يَظُنُّوْنَ اَنَّهُمْ مُّلِقُوْا رَبَّهُمْ

وَ اَنَّهُمْ اِلَيْهِ رٰجِعُوْنَ ۝ اَلَّذِيْنَ يَذْكُرُوْنَ

اَللّٰهَ قِيٰمًا وَّقَعُوْدًا وَّعَلٰى جُنُوْبِهِمْ وَيَتَفَكَّرُوْنَ

فِيْ خَلْقِ السَّمٰوٰتِ وَاَلْاَرْضِ رَبَّنَا مَا

خَلَقْتَ هٰذَا بٰطِلًا سُبْحٰنَكَ فَقِنَا عَذَابَ النَّارِ ۝

અલ્લાહુમ્મ-સલ્લિ-વ-સલ્લિમ-અલા-
 સય્દિના-મુહમ્મદિનિલ-બશીરિલ-
 મુબશ્શિરિ-લિલ-ખાશિઈન-બિમા-કા-
 લલ્લાહુલ-અઝીમ : વસ્તઈનુ-બિસ્સબ-રિ-
 વસ્સલાતિ-વ-ઇબ્નહા-લ-કબીરતુન-ઇલ્લા-
 અલલ-ખાશિઈન ૦ અલ્લમીન-યમુન્નૂન-
 અન્નહુમ-મુલાકૂ-રબ્બિહિમ-વ-અન્નહુમ-
 ઇલયહિ-રાજિબિન ૦ અલ્લમીન-યઝ-
 ફુરૂનલ્લાહ-કિયામંવ-વ-ફુઉદંવ-વ-અલા-
 જુનૂબિહિમ-વ-યતફક્કરૂન-ફી-
 ખલ્કિસ્સમાવાતિ-વલ-અર્દ-રબ્બના-મા-ખલ-
 કત-હાઝા-બાતિલન-સુબ્હાનક-
 ફ-કિના-અઝાબન્નાર ૦

તર્જમા

“ઐ અલ્લાહ પાક ! હમારે સરદાર હઝરતે સય્દિદુના
 મુહમ્મદ ﷺ પર દુરૂદ ભેજ, જો આજિઝી કરને
 વાલોં કો ખુશ ખબરી દેને વાલે હૈં. જૈસા કે અઝમત વાલે
 અલ્લાહ પાક કા ઈરશાદ હૈ કે ૦ “ઔર સબ્ર ઔર નમાઝ સે
 મદદ યાહો ઔર બેશક ! નમાઝ ઝરૂર ભારી હૈ મગર ઉન પર
 ભારી નહીં જો રબ કે હુઝૂર ગિળગિળાતે હૈ” ૦ “જિન્હેં યકીન
 હૈં કે ઉન્હેં અપને રબ સે મિલના હૈ ઔર ઉસી કી તરફ ફિરના

हे” ० “शे अल्लाह की याद करते हैं ढणे और बैठे और करवट पर लेटे और आस्मानों और जमीन की पैदाईश में गौर करते हैं. अरु हमारे ! तू ने येह बेकार न बनाया. पाकी है तुझे, तूहमें दोजभ के अजाब से बचा ले ०”

اللَّهُمَّ صَلِّ وَسَلِّمْ عَلَى سَيِّدِنَا مُحَمَّدٍ الْبَشِيرِ

الْمُبَشِّرِ لِلصَّابِرِينَ بِمَا قَالَ اللَّهُ الْعَظِيمُ : اِنَّمَّا

يُؤْتِي الصَّابِرُونَ اَجْرَهُمْ بِغَيْرِ حِسَابٍ ० اَوْلِيكَ

الَّذِينَ هَدَاهُمُ اللَّهُ وَاَوْلِيكَ هُمْ اَوْلُوا الْاَلْبَابِ ०

अल्लाहुम्म-सल्लि-व-सल्लिम-अला-
सय्यिदिना-मुहम्मदिनिल-अशीरिल-
मुअशिशिरि-लिससाबिरीन-अिमा-का-
लल्लाहुल-अमीम : धन्नमा-
युवक्कस्साबिइन-अज-रहुम-अिगैरि-
हिसाअ ० उलाधकल्लमीन-हदाहुमुल्लाहु-
व-उलाधक-हुम-उलुल-अल्लाअ ०

तर्जमा

“अै अल्लाह पाक ! हमारे सरदार हजरते सय्यिदुना मुहम्मद ﷺ पर दुरुद लेज, जो सभ्र करने वालों को भुश भभरी देने वाले हैं. जैसा के अजमत वाले अल्लाह पाक का ँरशाद है के ० “साबिरों ही को उन का सवाभ भरपूर दिया जाअेगा, बे गिनती” ० “येह है जिन को अल्लाह ने हिदायत इरमाई और येह हैं जिन को अकल है ०”

اللَّهُمَّ صَلِّ وَسَلِّمْ عَلَى سَيِّدِنَا مُحَمَّدٍ

إِلْبَشِيرِ الْمُبَشِّرِ لِلْخَائِفِينَ بِمَا قَالَ

اللَّهُ الْعَظِيمُ : ۞ وَلِمَنْ خَافَ مَقَامَ

رَبِّهِ جَنَّاتٍ ۞ وَأَمَّا مَنْ خَافَ مَقَامَ

رَبِّهِ وَنَهَى النَّفْسَ عَنِ الْهَوَىٰ فَيَأْتِ

الْجَنَّةَ هِيَ الْمَأْوَى ۞

અલ્લાહુમ્મ-સલ્લિ-
 વ-સલ્લિમ-અલા-સચ્ચિદિના-
 મુહમ્મદિનિલ-બશીરિલ-
 મુબશ્શિરિ-લિલ-ખાઘફીન-બિમા-કા-
 લલ્લાહુલ-અઝીમ : વ-લિમન-ખાફ-
 મકામ-રબ્બિહી-જન્નતાન ૦ વ-અમ્મા-
 મન-ખાફ-મકામ-રબ્બિહી-વ-ન-
 દન્નફસ-અનિલ-હવા ૦ ફ-
 ઇન્નલ-જન્નત-હિયલ
 માઅવા ૦

તર્જમા

“ઐ અલ્લાહ પાક ! હમારે સરદાર હઝરતે સચ્ચિદુના મુહમ્મદ ﷺ પર દુરૂદ ભેજ, જો ડરને વાલોં કો ખુશ ખબરી દેને વાલે હૈ જૈસા કે અઝમત વાલે અલ્લાહ પાક કા ઇરશાદ હૈ કે ૦ “ઐર જો અપને રબ કે હુઝૂર ખળે હોને સે ડરે, ઉસ કે લિએ દો જન્નતેં હૈં” ૦ “ઐર વોહ જો અપને રબ કે હુઝૂર ખળે હોને સે ડરા ઐર નફસ કો ખ્વાહિશ સે રોકા, તો બેશક ! જન્નત હી ઠિકાના હૈ ૦”

اَللّٰهُمَّ صَلِّ وَسَلِّمْ عَلٰى سَيِّدِنَا مُحَمَّدٍ

اَلْبَشِيْرِ الْمُبَشِّرِ الْمُبْتَقِيْنَ بِمَا قَالَ اللهُ

اَلْعَظِيْمُ : ۝ وَرَحْمَتِيْ وَسِعَتْ كُلَّ شَيْءٍ

فَسَاكُتْهَا الَّذِيْنَ يَتَّقُوْنَ وَيُوْتُوْنَ الزَّكٰوةَ

وَالَّذِيْنَ هُمْ بِاٰيٰتِنَا يُؤْمِنُوْنَ ۝ الَّذِيْنَ يَتَّبِعُوْنَ

الرَّسُوْلَ النَّبِيَّ الْاُمِّيَّ ۝ فَاُولٰٓئِكَ لَهُمْ جَزَاؤُ

الضَّعْفِ بِمَا عَمِلُوْا وَهُمْ فِي الْغُرْفٰتِ اٰمِنُوْنَ ۝

अल्लाहुम्म-सल्लि-व-सल्लिम-अला-
सय्यदिना-मुहम्मदिनिल-भशीरिल-
मुभश्शिरि-लिल-मुत्किथ्यिन-भिमा-
का-लल्लाहुल-अमीम : व-रहमती-
वसिअत-कुल्ल-शैधन-इ-सअकुतुबुहा-
लिल्लमीन-यत्कून-व-युअतूनम्माकात-

वल्लमीन-हुम-भलआयातलनल-
 युअमलनून ० अल्लमीन-
 यतभलडलनरंसूलन्नभलखलल-
 डभलखल ० इ-डललधक-लहुम-जलडडलडल-
 इ-भलमल-अभललु-वलहुम-
 इल-गुरुइलतल-आभलनून ०

तर्जुमल

“अै अल्ललड डलक ! डमलरे सरदलर डडरते सखलदुनल मुडम्मद صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ डर दुइद डेज, जे डरडेडगलर लुगुं कु डुश डडरी देने वलले हैं, जैसल के अडमत वलले अल्ललड डलक कल डरशलद है के ० “और डेरी रडमत डर खलज कु डेरे है, तु अनकरीड डें ने’मतुं कु उन के ललडे ललड दुंगल, जे डरते और डकलत देते हैं और डमलरी आडतुं डर डडलन ललते हैं” ० “वलड जे गुललडडी करेंगे उस रसूल डे डढे गैड की डडरें देने वलले की” ० “उन के अडल कल डदलल और वलड डललल डलनुं डें अडनु अडलन से है ०”

اللَّهُمَّ صَلِّ وَسَلِّمْ عَلَى سَيِّدِنَا مُحَمَّدٍ الْبَشِيرِ

الْمُبَشِّرِ لِلْمُخْبِتِينَ بِمَا قَالَ اللَّهُ الْعَظِيمُ: وَبَشِّرِ

الْمُخْتَبِينَ الَّذِينَ إِذَا ذُكِرَ اللَّهُ وَجِلَتْ قُلُوبُهُمْ ۝ وَالَّذِينَ

يُؤْتُونَ مَا آتَوْا وَقُلُوبُهُمْ وَجِلَةٌ أَنَّهُمْ إِلَىٰ رَبِّهِمْ رَاجِعُونَ ۝

أُولَٰئِكَ يُسِرُّونَ فِي الْخَيْرَاتِ وَهُمْ لَهَا سَابِقُونَ ۝

અલ્લાહુમ્મ-સલ્લિ-વ-સલ્લિમ-અલા-
સચ્ચિદિના-મુહમ્મદિનિલ-બશીરિલ-
મુબશ્શિરિ-લિલ-મુખ્બિતીન-બિમા-કા-
લલ્લાહુલ-અમીમ : વ-બશ્શિરિલ
મુખ્બિતીનલ્લમીન-ઘઝા-મુકિરલ્લાહુ-વ-
જિલત-ફુલૂબુહુમ-વલ્લમીન-યુઅતૂન-મા-
આતવ્વફુલૂબુહુમ-વ-જિલતુન-અન્નહુમ-
ઘલા-રબ્બિહિમ-રાજિહીન ० ઉલાઘક-
યુસારિહીન-ફિલ-ખેરાતિ-વહુમ-
લહા-સાબિકૂન ०

તર્જમા

“એ અલ્લાહ પાક ! હમારે સરદાર હઝરતે સચ્ચિદુના મુહમ્મદ ﷺ પર દુરુદ ભેજ, જો આજિઝી કરને વાલોં કો ખુશ ખબરી દેને વાલે હેં, જૈસા કે અઝમત વાલે અલ્લાહ

पाक का ँरशाद है के ० “और अै मडबूब ! ढुशी सुना दै उन तवाओअ वारों को के जब अल्लाड पाक का ञिक डोता है, उन के दल डरने लगते है” ० “और वोड जो देते हैं, जो कुड दं और उन के दल डर रहे हैं, यूं के उन को अपने रड की तरफ डरना है” ० “येड लोग भलाधयों में जलदी करते हैं और येडी सड से पहले उन्हें पहुंये ०”

اللَّهُمَّ صَلِّ وَسَلِّمْ عَلَى سَيِّدِنَا مُحَمَّدٍ الْبَشِيرِ الْمُبَشِّرِ

لِلصَّابِرِينَ بِمَا قَالَ اللَّهُ الْعَظِيمُ: وَبَشِّرِ الصَّابِرِينَ ०

الَّذِينَ إِذَا أَصَابَتْهُمُ مُصِيبَةٌ قَالُوا إِنَّا لِلَّهِ وَإِنَّا إِلَيْهِ

رُجِعُونَ ० أُولَئِكَ عَلَيْهِمْ صَلَوَاتٌ مِنْ رَبِّهِمْ وَرَحْمَةٌ

وَأُولَئِكَ هُمُ الْمُبْتَدُونَ ० إِنِّي جَزَيْتُهُمُ الْيَوْمَ بِمَا

صَبَرُوا إِنَّهُمْ هُمُ الْفَائِزُونَ ०

અલ્લાહુમ્મ-સલ્લિ-વ-સલ્લિમ-અલા-
 સય્યિદિના-મુહમ્મદિનિલ-બશીરિલ-
 મુબશ્શિરિ-લિસ્સાબિરીન-બિમા-કા-
 લલ્લાહુલ-અઝીમ : વ-બશ્શિરિસ્સાબિરીન ૦
 અલ્લઝીન-ઘઝા-અસાબતહુમ-મુસીબતુન-
 કાલૂ-ઘન્ના-લિલ્લાહિ-વ-ઘન્ના-ઘલયહિ-
 રાજિઊન ૦ ઉલાઘક-અલયહિમ-
 સલવાતુમ્મિન-રબ્બિહિમ-વ-રહમતુવં-
 વ-ઉલાઘક-હુમુલ મુહતદૂન ૦ ઘન્ની
 જઝયતુહુમુલયૌમ-બિમા-સબર-અન્નહુમ-
 હુમુલ-ફાઘૂન ૦

તર્જમા

“ઐ અલ્લાહ પાક ! હમારે સરદાર હઝરતે સય્યિદુના
 મુહમ્મદ ﷺ પર દુરૂદ ભેજ, જો સબ્ર કરને વાલોં
 કો ખુશ ખબરી દેને વાલે હૈ, જૈસા કે અઝમત વાલે અલ્લાહ
 પાક કા ઈરશાદ હૈ કે ૦ “ઔર ખુશ ખબરી સુના ઉન સબ્ર
 વાલોં કો, કે જબ ઉન પર કોઈ મુસીબત પળે, તો કહે : હમ
 અલ્લાહ પાક કે માલ હૈં ઔર હમ કો ઉસી કી તરફ ફિરના. યેહ
 લોગ હૈ જિન પર ઉન કે રબ કી દુરૂદે હૈં ઔર રહમત ઔર યેહી
 લોગ રાહ પર હૈ” ૦ “બેશક ! આજ મૈં ને ઉન કે સબ્ર કા ઉન્હેં
 યેહ બદલા દિયા કે વોહી કામ્યાબ હૈ ૦”

اَللّٰهُمَّ صَلِّ وَسَلِّمْ عَلٰى سَيِّدِنَا مُحَمَّدٍ الْبَشِيْرِ الْبَشِيْرِ

لِلْكَاطِبِيْنَ بِمَا قَالِ اللهُ الْعَظِيْمُ: الَّذِيْنَ يَنْفُقُوْنَ

وَالْكَظِيْمِيْنَ الْغِيْظِ فِي السَّرِّ آءِ وَالضَّرِّ آءِ وَالْعَافِيْنَ

عَنِ النَّاسِ وَاللّٰهُ يُحِبُّ الْهُسَيْنِيْنَ ۝ فَمَنْ عَفَا وَاصْلَحَ

فَاَجْرُهُ عَلٰى اللهِ اِنَّهُ لَا يُحِبُّ الظَّالِمِيْنَ ۝

અલ્લાહુમ્મ-સલ્લિ-વ-સલ્લિમ-અલા-
સય્યિદિના-મુહમ્મદિનિલ-બશીરિલ-
મુબશ્શિરિ-લિલ-કાઠિમીન-બિમા-કા-
લલ્લાહુલ-અઠીમ : અલ્લાઠીન-યુન્ફિફૂન-
ફિસ્સર્રાઈ-વદ્દર્રાઈ-વલ-કાઠિમીનલ-ગૈઝ-વલ-
આફીન-અનિન્નાસિ-વલ્લાહુ-યુહિબ્બુલ-મુહ-
સિનીન ० ફમન-અફા-વ-અસ્લહ-ફ-
અજર્રહુ-અલલ્લાહિ-ઇન્નહુ-લા-
યુહિબ્બુઝ્ઝાલિમીન ०

તર્જમા

“એ અલ્લાહ પાક ! હમારે સરદાર હઝરતે સય્યિદુના
મુહમ્મદ, صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ પર દુરુદ ભેજ, જો ગુસ્સે કો પી જાને

वालुं कु भुश भबरी देने वाले हैं, जैसा के अजमत वाले अल्लाह पाक का धरशाद है के ० “वोह जो अल्लाह की राह में भर्य करते हैं, भुशी में और रंज में और गुस्सा पीने वाले और लुगुं से दर गुजर करने वाले और नेक लुग अल्लाह के मलबूब है” ० “तु जिस ने मुआफ़ किया और काम संवारा उस का अज्ज अल्लाह पाक पर है. बेशक ! वोह दोस्त नहीं रहता जालिभुं कु ०”

اللَّهُمَّ صَلِّ وَسَلِّمْ عَلَى سَيِّدِنَا مُحَمَّدٍ الْبَشِيرِ

الْمُبَشِّرِ لِلْمُحْسِنِينَ بِمَا قَالَ اللَّهُ الْعَظِيمُ:

وَأَحْسِنُوا إِنَّ اللَّهَ يُحِبُّ الْمُحْسِنِينَ ० مَنْ

جَاءَ بِالْحَسَنَةِ فَلَهُ عَشْرُ أَمْثَالِهَا وَمَنْ جَاءَ

بِالسَّيِّئَةِ فَلَا يُجْزَى إِلَّا مِثْلَهَا وَهُمْ لَا يُظْلَمُونَ ०

અલ્લાહુમ્મ-સલ્લિ-વ-સલ્લિમ-અલા-
 સચ્ચિદિના-મુહમ્મદિનિલ-બશીરિલ-
 મુબશ્શિરિ-લિલ-મુહસિનીન-બિમા-કા-
 લલ્લાહુલ-અઝીમ : વ-અહસિનૂ-
 ઇન્નલ્લાહ-યુહિબ્બુલ-મુહસિનીન ૦
 મન-જાઅ-બિલ-હસનતિ-ફલહુ-અશરુ-
 અમ્સાલિહા-વ-મન-જાઅ-બિસ્સચ્ચિઅતિ-
 ફલા-યુજાઝા-ઇલ્લા-મિસ્લહા-વ-હુમ-લા-
 યુઝલમૂન ૦

તર્જમા

“ઐ અલ્લાહ પાક ! હમારે સરદાર હઝરતે સચ્ચિદુના મુહમ્મદ ﷺ પર દુરુદ ભેજ, જો ભલાઈ કરને વાલોં કો ખુશ ખબરી દેને વાલે હૈં, જૈસા કે અઝમત વાલે અલ્લાહ પાક કા ઈરશાદ હૈં કે ૦ “ઐર ભલાઈ વાલે હો જાઓ બેશક ! ભલાઈ વાલે અલ્લાહ કે મહબૂબ હૈ” ૦ “જો એક નેકી લાએ તો ઉસ કે લિયે ઉસ જૈસી દસ હૈ ઐર જો બુરાઈ લાએ તો ઉસે બદલા ન મિલેગા મગર ઉસ કે બરાબર ઐર ઉન પર ઝુલ્મ ન હોગા ૦”

اللَّهُمَّ صَلِّ وَسَلِّمْ عَلَى سَيِّدِنَا مُحَمَّدٍ الْبَشِيرِ

الْمُبَشِّرِ لِلْمُتَصَدِّقِينَ بِمَا قَالَ اللَّهُ الْعَظِيمُ :

وَأَنْ تَصَدَّقُوا خَيْرٌ لَكُمْ ۝ إِنَّ اللَّهَ يُجْزِي

الْمُتَصَدِّقِينَ ۝

अल्लाहुम्म-सल्लि-व-सल्लिम-अला-
सय्यिदिना-मुहम्मदिनिल-अशीरिल-
मुअशिशिरि-लिल-मुतसदिडीन-अिमा-का-
लल्लाहुल-अमीम : व-अन-तसदकू-
भेरुल्लकुम-धन-कुन्तुम-तअ-लमून ०
धन्नल्लाह-यज-अिल मुतसदिडीन ०

तर्जमा

“अै अल्लाह पाक ! हमारे सरदार हजरते सय्यिदुना मुहम्मद صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ पर दुरुद भेज, जो सदका देने वालों को भुश भबरी देने वाले हैं जैसा के अजमत वाले अल्लाह पाक का एरशाह है के ० “और येह के सदका देना तुम्हारे लिये बेहतर है, अगर तुम जानो” ० “बेशक ! अल्लाह पाक भेरात वालों को सिवा देता है ०”

اللَّهُمَّ صَلِّ وَسَلِّمْ عَلَى سَيِّدِنَا مُحَمَّدٍ الْبَشِيرِ

الْمُبَشِّرِ لِلْمُنْفِقِينَ بِمَا قَالَ اللَّهُ الْعَظِيمُ :

وَمَا رَزَقْنَاهُمْ يُنْفِقُونَ ○ وَمَا أَنْفَقْتُمْ مِنْ

شَيْءٍ فَهُوَ يُخْلِفُهُ ○ وَهُوَ خَيْرُ الرَّازِقِينَ ○

अल्लाहुम्म-सल्लि-व-सल्लिम-अला-
सय्यिदिना-मुहम्मदिनिल-अशीरिल-
मुअशिशिरि-लिल-मुन्फिकीन-अिमा-का-
लल्लाहुल-अअीम : व-मिम्मा-रअकनाहुम-
युन्फिकून-वमा-अन्फकुतुम्मिन-शयधन-
इहुव-युप्फिकुह ○ व-हुव भैरुराअिकीन ○

तर्जुमा

“अै अल्लाह पाक ! हमारे सरदार हजरते सय्यिदुना मुहम्मद صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ पर दुरुद भेज, जो अल्लाह पाक की राह में अर्य करने वालों को अुश अअरी देने वाले है जैसा के अअमत वाले अल्लाह पाक का धरशाह है के ○ “और हमारी दी हुध रोजी में से हमारी राह में अर्य करते है” ○ “और जो यीअ तुम अल्लाह की राह में अर्य करो वोह उस के अदले और देगा और वोह सब से अहेतर रिअक देने वाला है ○”

اللَّهُمَّ صَلِّ وَسَلِّمْ عَلَى سَيِّدِنَا مُحَمَّدٍ الْبَشِيرِ

الْمُبَشِّرِ لِلشَّاكِرِينَ بِمَا قَالَ اللَّهُ الْعَظِيمُ : وَأَشْكُرُوا

نِعْمَتَ اللَّهِ إِنَّ كُنْتُمْ آيَاةً تَعْبُدُونَ لَئِنْ شَكَرْتُمْ

لَأَزِيدَنَّكُمْ وَلَئِنْ كَفَرْتُمْ إِنَّ عَذَابِي لَشَدِيدٌ ۝

अल्लाहुम्म-सल्लि-व-सल्लिम-अला-
सय्यिदिना-मुहम्मदिनिल-भशीरिल-मुभश्शिरि-
लिश्शाकिरीन-भिमा-का-लल्लाहुल-अमीम :
वशकुइ-निअमतल्लाहि-धन-कुन्तुम-धय्याहु-
तअभुदून ० लधन-शकरतुम-ल-अमीदन्नकुम-
व-लधन-कइरतुम-धन्न-अमागी-लशदीद ०

तर्जमा

“अै अल्लाह पाक ! हमारे सरदार हजरते सय्यिदुना मुहम्मद ﷺ पर दुइद भेज, जो शुक्र करने वालों को भुश भबरी देने वाले है जैसा के अजमत वाले अल्लाह पाक का धरशाद है के ० “और अल्लाह की ने’मत का शुक्र करो अगर तुम उस की धभादत करते हो” ० “अगर शुक्र करोगे तो में तुम्हें और दूंगा और अगर ना शुकी करोगे तो मेरा अजाब सप्त है ०”

اَللّٰهُمَّ صَلِّ وَسَلِّمْ عَلٰى سَيِّدِنَا مُحَمَّدٍ الْبَشِيْرِ

اَلْمُبَشِّرِ لِلْسَّائِلِيْنَ بِمَا قَالَ اللهُ الْعَظِيْمُ :

فَاِنِّيْ قَرِيْبٌ اَجِيْبُ دَعْوَةَ الدَّاعِ اِذَا دَعَانِ

وَ قَالَ رَبُّكُمْ اَدْعُوْنِيْ اَسْتَجِبْ لَكُمْ

અલ્લાહુમ્મ-સલ્લિ-વ-સલ્લિમ-અલા-

સચ્ચિદિના-મુહમ્મદિનિલ-બશીરિલ-

મુબશ્શિરિ-લિસ્સાઘલીન-બિમા-કા-

લલ્લાહુલ-અઝીમ : ફ-ઇન્ની-કરીબુન-

ઉજુબુ-દઅવતદાઘ-ઇઝા-દઆન ૦ વ-કાલ

રબુકુમુદઇની-અસ્તજિબ-લકુમ ૦

તર્જમા

“ઐ અલ્લાહ પાક ! હમારે સરદાર હઝરતે સચ્ચિદુના મુહમ્મદ ﷺ પર દુરુદ ભેજ, જો અલ્લાહ પાક સે માંગને વાલોં કો ખુશ ખબરી દેને વાલે હેં જૈસા કે અઝમત વાલે અલ્લાહ પાક કા ઈરશાદ હૈ કે ૦ “તો મૈં નઝદીક હૂં, દુઆ કબૂલ કરતા હૂં પુકારને વાલે કી, જબ મુઝે પુકારે” ૦ “ઐર તુમ્હારે રબ ને ફરમાયા : મુઝ સે દુઆ કરો, મૈં કબૂલ કરૂંગા ૦”

اَللّٰهُمَّ صَلِّ وَسَلِّمْ عَلٰى سَيِّدِنَا مُحَمَّدٍ الْبَشِيْرِ

اَلْمُبَشِّرِ لِّلصّٰلِحِيْنَ بِمَا قَالَ اللهُ الْعَظِيْمُ : اِنَّ اَلْاَرْضَ

يَرِيْثُهَا عِبَادِي الصّٰلِحُوْنَ ۝ اَوْلٰئِكَ هُمُ الْوَرِثُوْنَ

اَلَّذِيْنَ يَرِثُوْنَ الْفِرْدَوْسَ هُمْ فِيْهَا خٰلِدُوْنَ ۝

અલ્લાહુમ્મ-સલ્લિ-વ-સલ્લિમ-અલા-
સચ્ચિદિના-મુહમ્મદિનિલ-બશીરિલ-
મુબશ્શિરિ-લિસ્સાલિહીન-બિમા-કાલલ્લાહુલ-
અગીમ : અન્નલ-અદ-ચરિસુહા
ઘબાદિયસ્સાલિહૂન-ઉલાઘક-હુમુલ-
વારિસૂન ० અલ્લાગીન-ચરિસૂનલ-ફિરદૌસ-
હુમ-ફીહા-ખાલિદૂન ०

તર્જમા

“એ અલ્લાહ પાક ! હમારે સરદાર હઝરતે સચ્ચિદુના મુહમ્મદ صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ પર દુરુદ ભેજ, જો નેક લોગોં કો ખુશ ખબરી દેને વાલે હૈં જૈસા કે અઝમત વાલે અલ્લાહ પાક કા ઇરશાદ હૈ કે ० “બેશક ! ઇસ ઝમીન કે વારિસ મેરે નેક બન્દે હોંગે” ० “યેહી લોગ વારિસ હૈ ફિરદૌસ કી મીરાસ પાઓંગે વોહ ઉસ મેં હમેશા રહેંગે ०”

اَللّٰهُمَّ صَلِّ وَسَلِّمْ عَلٰى سَيِّدِنَا مُحَمَّدٍ الْبَشِيْرِ

اَلْمُبَشِّرِ لِمُصَلِّيْنَ بِمَا قَالَ اللهُ الْعَظِيْمُ : اِنَّ اللهَ

وَمَلَائِكَتُهٗ يُصَلُّوْنَ عَلٰى النَّبِيِّ يَاۡٓئِهٖا الَّذِيْنَ اٰمَنُوْا

صَلُّوْا عَلَيْهِ وَسَلِّمُوْا تَسْلِيْمًا ۝ يُّوْتِكُمْ كِفٰلِيْنَ

مِّنْ رَّحْمَتِهٖ وَيَجْعَلْ لَّكُمْ نُوْرًا تَمْشُوْنَ بِهٖ وَيَغْفِرْ

لَكُمْ وَاللهٗ غَفُوْرٌ رَّحِيْمٌ ۝

અલ્લાહુમ્મ-સલ્લિ-વ-સલ્લિમ-અલા-
સચ્ચિદિના-મુહમ્મદિનિલ-બશીરિલ-
મુબશ્શિરિ-લિલ-મુહસિનીન-ભિમા-કા-
લલ્લાહુલ-અમીમ : ઇન્નલ્લાહ વ-
મલાઇકતહુ-યુસલ્લૂન-અલન્નબિચ્ચિ-યા-
અચ્ચહલ્લમીન-આમનૂ-સલ્લૂ-અલયહિ-વ-
સલ્લિમૂ-તસ્લીમા ० યૂઅતિકુમ-કિફલેનિ-
મિર્રહમતિહી-વ-યજઅલ-લકુમ-નૂરન-
તમ્શૂન-ભિહી-વ-યગ્ફિર-લકુમ-
વલ્લાહુ-ગફુરુર્રહીમ

तर्जमा

“अै अल्लाह पाक ! हमारै सरदार हजरते सय्यिदुना मुहम्मद ﷺ पर दुरुद भेज, जो नेकी करने वालों को भुश भबरी देने वाले हैं जैसा के अजमत वाले अल्लाह पाक का ँरशाह है के ० “बेशक ! अल्लाह पाक और उस के इरिशते दुरुद भेजते हैं उस गैभ भताने वाले (नबी) पर अै ँमान वालो ! उन पर दुरुद और भूभ सलाम भेजो” ० “वोह अपनी रहमत के दो हिससे तुम्हें अता इरमाअेगा और तुम्हारे दिये नूर कर देगा, जिस में यलो और तुम्हें भप्श देगा और अल्लाह भप्शने वाला महेरभान है ०”

اللَّهُمَّ صَلِّ وَسَلِّمْ عَلَى سَيِّدِنَا مُحَمَّدٍ الْبَشِيرِ

الْمُبَشِّرِ لِلْمُبَشِّرِينَ بِمَا قَالَ اللَّهُ الْعَظِيمُ: ۞ وَبَشِّرِ

الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ ۞ لَهُمُ الْبُشْرَى

فِي الْحَيَاةِ الدُّنْيَا وَفِي الْآخِرَةِ لَا تَبْدِيلَ لِكَلِمَاتِ اللَّهِ

ذَلِكَ هُوَ الْفَوْزُ الْعَظِيمُ ۞

અલ્લાહુમ્મ-સલ્લિ-વ-સલ્લિમ-અલા-
સય્યિદિના-મુહમ્મદિનિલ-બશીરિલ-
મુબશ્શિરિ-લિલ-મુબશ્શિરીન-બિમા-કા-
લલ્લાહુલ-અઝીમ : વ-બશ્શિરિલલ્લઝીન-
આમનૂ-વ-અમિલુસ્સાલિહાત ૦ લહુમુલ-
બુશરા-ફિલ-હયાતિદુન્યા-વ-ફિલ-
આખિરતિ-લા-તબ્દીલ-લિકલિમાતિલ્લાહિ-
ઝાલિક-હુવલ-ફવઝુલ-અઝીમ ૦

તર્જમા

“ઐ અલ્લાહ પાક ! હમારે સરદાર હઝરતે સય્યિદુના મુહમ્મદ ﷺ પર દુરુદ ભેજ, જો ખુશ ખબર દેને વાલોં કો ખુશ ખબરી દેને વાલે હેં જૈસા કે અઝમત વાલે અલ્લાહ પાક કા ઈરશાદ હૈ કે ૦ “ઔર ખુશ ખબરી દે ઉન્હેં જો ઈમાન લાએ ઔર અચ્છે કામ કિયે” ૦ “ઉન્હેં ખુશ ખબરી હૈ દુન્યા કી ઝિન્દગી મેં ઔર આખિરત મેં અલ્લાહ કી બાતેં બદલ નહીં સકતીં, યેહી બળી કામ્યાબી હૈ ૦”

اللَّهُمَّ صَلِّ وَسَلِّمْ عَلَى سَيِّدِنَا مُحَمَّدٍ الْبَشِيرِ

الْمُبَشِّرِ لِلْفَائِزِينَ بِمَا قَالَ اللَّهُ الْعَظِيمُ :

وَمَنْ يُطِعِ اللَّهَ وَرَسُولَهُ فَقَدْ فَازَ فَوْزًا عَظِيمًا ۝

અલ્લાહુમ્મ-સલ્લિ-વ-સલ્લિમ-અલા-
સય્યિદિના-મુહમ્મદિનિલ-બશીરિલ-
મુબશ્શિરિ-લિલફાઘઝીન-બિમા-કા-
લલ્લાહુલ-અઝીમ : વમન-યુતિઘલ્લાહ-વ-
રસૂલહુ-ફકદ-ફાઝ-ફવઝન-અઝીમા ૦

તર્જમા

“ઐ અલ્લાહ પાક ! હમારે સરદાર હઝરતે સય્યિદુના મુહમ્મદ ﷺ પર દુરુદ ભેજ, જો મુરાદ પાને વાલોં કો ખુશ ખબરી દેને વાલે હેં, જૈસા કે અઝમત વાલે અલ્લાહ પાક કા ઈરશાદ હૈ કે ૦ “ઐર જો અલ્લાહ ઐર ઉસ કે રસૂલ કી ફરમાં બરદારી કરે, ઉસ ને બળી કામ્યાબી પાઈ.”

اللَّهُمَّ صَلِّ وَسَلِّمْ عَلَى سَيِّدِنَا مُحَمَّدٍ الْبَشِيرِ

الْمُبَشِّرِ لِزَاهِدِينَ بِمَا قَالَ اللَّهُ الْعَظِيمُ :

الْبَالِ وَالْبَنُونَ زِينَةُ الْحَيَاةِ الدُّنْيَا وَالْبَقِيَّةُ

الصَّلَاحُ خَيْرٌ عِنْدَ رَبِّكَ ثَوَابًا وَخَيْرٌ أَمَلًا ۝

અલ્લાહુમ્મ-સલ્લિ-વ-સલ્લિમ-અલા-
 સચ્ચિદિના-મુહમ્મદિનિલ-બશીરિલ-
 મુબશ્શિરિ-લિમ્મ્માહિદીન-બિમા-કા-
 લલ્લાહુલ-અઝીમ : અલમાલુ-વલ-બનૂન-
 ઝીનતુલ-હયાતિદુન્યા-વલ-
 બાકિયાતુસ્સાલિહાતુ-ખૈરુન-ધન્દ-રઢિબક-
 સવાબંવ-વ-ખૈરુન-અમલા ૦

તર્જમા

“ઐ અલ્લાહ પાક ! હમારે સરદાર હઝરતે સચ્ચિદુના મુહમ્મદ ﷺ પર દુરુદ ભેજ, જો પરહેઝગારોં કો ખુશ ખબરી દેને વાલે હૈં જૈસા કે અઝમત વાલે અલ્લાહ પાક કા ઈરશાદ હૈં કે ૦ “માલ ઓર બેટે યેહી જીતી (ઝિન્દા) દુન્યા કા સિંગાર હૈં ઓર બાકી રહને વાલી અચ્છી બાતેં, ઉન કા સવાબ તુમ્હારે રબ કે યહાં બેહતર ઓર વોહ ઉમ્મીદ મેં સબ સે ભલી ૦”

اَللّٰهُمَّ صَلِّ وَسَلِّمْ عَلٰى سَيِّدِنَا مُحَمَّدٍ الْبَشِيْرِ

اَلْبَشِيْرِ لِلْاُمِّيِّينَ بِمَا قَالَهُ اللهُ الْعَظِيْمُ :

كُنْتُمْ خَيْرَ اُمَّةٍ اُخْرِجَتْ لِلنَّاسِ

تَأْمُرُوْنَ بِالْعُرُوْفِ وَتَنْهَوْنَ عَنِ الْمُنْكَرِ ۝

અલ્લાહુમ્મ-સલ્લિ-વ-સલ્લિમ-અલા-
સચ્ચિદિના-મુહમ્મદિનિલ-બશીરિલ-
મુબશ્શિરિ-લિલ-ઉમ્મિય્ચીન-બિમા-કા-
લલ્લાહુલ-અઝીમ : કુન્તુમ-ખેર-ઉમ્મતિન-
ઉખ-રિજત-લિન્નાસિ-તઅમુરુન-બિલ-
મઅરુફિ-વ-તન્હવન-અનિલ-મુન્કર ૦

તર્જમા

“ઐ અલ્લાહ પાક ! હમારે સરદાર હઝરતે સચ્ચિદુના મુહમ્મદ صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ પર દુરુદ ભેજ, જો બે પઢે લિખે લોગોં કો ખુશ ખબરી દેને વાલે હેં જૈસા કે અઝમત વાલે અલ્લાહ પાક કા ઈરશાદ હૈ કે ૦ “તુમ બેહતર હો ઉન સબ ઉમ્મતોં મેં જો લોગોં મેં ઝાહિર હુઈ, ભલાઈ કા હુકમ દેતે હો ઓર બુરાઈ સે મન્અ કરતે હો ૦”

اللَّهُمَّ صَلِّ وَسَلِّمْ عَلَى سَيِّدِنَا مُحَمَّدٍ الْبَشِيرِ

الْمُبَشِّرِ لِلْمُصْطَفَيْنِ بِمَا قَالَ اللَّهُ الْعَظِيمُ :

ثُمَّ أَوْرَثْنَا الْكِتَابَ الَّذِينَ اصْطَفَيْنَا مِنْ عِبَادِنَا

فَمِنْهُمْ ظَالِمٌ لِّنَفْسِهِ وَمِنْهُمْ مُقْتَصِدٌ وَمِنْهُمْ

سَابِقٌ بِالْخَيْرَاتِ يُأْتِنُ اللَّهُ ذَلِكَ هُوَ الْفَضْلُ الْكَبِيرُ ٥

અલ્લાહુમ્મ-સલ્લિ-વ-સલ્લિમ-અલા-
 સચ્ચિદિના-મુહમ્મદિનિલ-બશીરિલ-
 મુબશ્શિરિ-લિલ-મુસ્તફીન-બિમા-કા-
 લલ્લાહુલ-અઝીમ : સુમ્મ-અવ-રસનલ-
 કિતાબલ્લઝીનસ્તફૈના-મિન-ઘબાદિના-
 ફમિન્હુમ-ઝાલિમુલ્લિનફિસહિ-વ-મિન્હુમ-
 મુક્તસિદુન-વ-મિન્હુમ-સાબિકુમ-બિલ-
 ખેરાતિ-બિઘમ્નિલ્લાહિ-ઝાલિક-હુવલ-
 ફઝલુલ-કબીર ૦

તર્જમા

“ઐ અલ્લાહ પાક ! હમારે સરદાર હઝરતે સચ્ચિદુના મુહમ્મદ ﷺ પર દુરુદ ભેજ, જો બરગુઝીદા લોગોં કો ખુશ ખબરી દેને વાલે હેં જૈસા કે અઝમત વાલે અલ્લાહ પાક કા ઈરશાદ હૈ કે ૦ “ફિર હમ ને કિતાબ કા વારિસ કિયા, અપને ચુને હુએ (Selected) બન્દોં કો, તો ઉન મેં કોઈ અપની જાન પર ઝુલ્મ કરતા હૈ ઓર ઉન મેં કોઈ મિયાના ચાલ (દરમિયાની ચાલ) પર હેં ઓર ઉન મેં કોઈ વોહ હેં જો અલ્લાહ કે હુકમ સે ભલાઈયોં મેં સબકત લે ગયા, યેહી બળા ફઝલ હૈ ૦”

اللَّهُمَّ صَلِّ وَسَلِّمْ عَلَى سَيِّدِنَا مُحَمَّدٍ الْبَشِيرِ

الْمُبَشِّرِ لِلْمُذْنِبِينَ بِمَا قَالَ اللَّهُ الْعَظِيمُ : قُلْ يُعْبَادِي

الَّذِينَ أَسْرَفُوا عَلَىٰ أَنفُسِهِمْ لَا تَقْنَطُوا مِن رَّحْمَةِ اللَّهِ

إِنَّ اللَّهَ يَغْفِرُ الذُّنُوبَ جَمِيعًا إِنَّهُ هُوَ الْغَفُورُ الرَّحِيمُ ۝

અલ્લાહુમ્મ-સલ્લિ-વ-સલ્લિમ-અલા-
સચ્ચિદિના-મુહમ્મદિનિલ-બશીરિલ-મુબશ્શિરિ-
લિલ-મુઝ્નિબીન-બિમા-કા-લલ્લાહુલ-અઝીમ :
કુલ-યા-ઘબાદિયલ્લાઝીન-અસ-રફૂ-અલા-
અન્કુસિહિમ-લા-તકનતૂ-મિર્હમતિલ્લાહિ-
ઘન્નલ્લાહ-યગફિરુઝ્ઝુનૂબ-જમીઅન-ઘન્નહુ-
હુવલ-ગફૂરર્હીમ ૦

તર્જમા

“ઐ અલ્લાહ પાક ! હમારે સરદાર હઝરતે સચ્ચિદુના મુહમ્મદ ﷺ પર દુરુદ ભેજ, જો ગુનહગારોં કો ખુશ ખબરી દેને વાલે હૈં જૈસા કે અઝમત વાલે અલ્લાહ પાક કા ઇરશાદ હૈ કે ૦ “તુમ ફરમાઓ ઐ મેરે વોહ બન્દો ! જિન્હોં ને અપની જાનોં પર ઝિયાદતી કી, અલ્લાહ કી રહમત સે ના ઉમ્મીદ ન હો, બેશક ! અલ્લાહ સબ ગુનાહ બખ્શ દેતા હૈ, બેશક ! વોહી બખ્શને વાલા મહેરબાન હૈ ૦”

اَللّٰهُمَّ صَلِّ وَسَلِّمْ عَلٰى سَيِّدِنَا مُحَمَّدٍ الْبَشِيْرِ

اَلْمُبَشِّرِ لِّلْمُسْتَغْفِرِيْنَ بِمَا قَالَ اللهُ الْعَظِيْمُ :

وَمَنْ يَّعْمَلْ سُوْءًا اَوْ يَظْلِمْ نَفْسَهُ ثُمَّ

يَسْتَغْفِرِ اللهُ يَجِدِ اللهُ غَفُوْرًا رَّحِيْمًا ۝

અલ્લાહુમ્મ-સલ્લિ-વ-સલ્લિમ-અલા

સચ્ચિદિના-મુહમ્મદિનિલ-બશીરિલ

મુબશ્શિરિ-લિલ-મુસ્તાગફિરીન-બિમા-કા

લલ્લાહુલ-અઝીમ : વ-મંચ્યઅમલ-સૂઅન

અવ-યઝલિમ-નફ્સહુ-સુમ્મ-યસ્તગ-

ફિરિલ્લાહ-યજિદિલ્લાહ-ગફૂર્રહીમા ૦

તર્જમા

“ઐ અલ્લાહ પાક ! હમારે સરદાર હઝરતે સચ્ચિદુના મુહમ્મદ ﷺ પર દુરુદ ભેજ, જો બખ્શિશ માંગને વાલોં (ઇસ્તિગ્ફાર કરને વાલોં) કો ખુશ ખબરી દેને વાલે હું જૈસા કે અઝમત વાલે અલ્લાહ પાક કા ઈરશાદ હે કે ૦ “ઔર જો કોઈ બુરાઈ કરે યા અપની જાન પર ઝુલ્મ કરે, ફિર અલ્લાહ સે બખ્શિશ ચાહે તો ઝરૂર અલ્લાહ કો બખ્શને વાલા મહેરબાન પાએગા ૦”

اللَّهُمَّ صَلِّ وَسَلِّمْ عَلَى سَيِّدِنَا مُحَمَّدٍ الْبَشِيرِ

الْمُبَشِّرِ لِمُقَرَّبِينَ بِمَا قَالَ اللَّهُ الْعَظِيمُ : إِنَّ الَّذِينَ

سَبَقَتْ لَهُمْ مِنَّا الْحُسْنَىٰ أُولَٰئِكَ عَنْهَا مُبْعَدُونَ

لَا يَسْمَعُونَ حَسِيسَتَهَا ۖ وَهُمْ فِي مَا اشْتَهَتْ أَنفُسُهُمْ

خَالِدُونَ ۝ لَا يَحْزَنُهُمُ الْفَزَعُ الْأَكْبَرُ وَتَتَلَقَّهُمُ

الْبَلَايِكُ ۖ هَذَا يَوْمُكُمْ الَّذِي كُنْتُمْ تُوعَدُونَ ۝

અલ્લાહુમ્મ-સલ્લિ-વ-સલ્લિમ-અલા-
સય્દિના-મુહમ્મદિનિલ-બશીરિલ-
મુબશ્શિરિ-લિલ-મુકર્રબીન-બિમા-કા-
લલ્લાહુલ-અઝીમ : ઇન્નલ્લઝીન-સબકત-
લહુમ્મિન્નલ-હુસ્ના-ઉલાઘક-અન્હા-
મુબઅદૂન ૦ લા-યસ્મઉન-હસીસહા-વ-
હુમ-ફી-મશ્તહત-અન્ફુસુહુમ-ખાલિદૂન ૦
લા- યહજુનુહુમુલફઝઅલ-અકબર-વ-
તતલક્કાહુમુલ-મલાઘકતુ ૦ હાગા-
યૌમુકુમુલ્લાગી-ફુન્તુમ-તૂઅદૂન ૦

तर्जमा

“अै अल्लाह पाक ! हमारे सरदार हजरते सय्यिदुना मुहम्मद ﷺ पर दुरुद भेज, जो अल्लाह का कुर्ब हासिल करने वालों को भुश भबरी देने वाले हैं जैसा के अजमत वाले अल्लाह पाक का ँरशाद है के ० “बेशक ! वोह जिन के लिये हमारा वा’दा भलाई का हो युका वोह अपनी मन मानती भ्वाहिशों में हमेशा रहेंगे” ० “उन्हें गम में न डालेगी वोह सब से भणी गभराहट और झिरिश्ते उन की पेश्वाई को आअेंगे के येह हैं तुम्हारा वोह दिन जिस का तुम से वा’दा था ०”

اَللّٰهُمَّ صَلِّ وَسَلِّمْ عَلٰى سَيِّدِنَا مُحَمَّدٍ الْبَشِيْرِ

اَلْمُبَشِّرِ الْمُسْلِمِيْنَ بِمَا قَالَ اللهُ الْعَظِيْمُ :

اِنَّ الْمُسْلِمِيْنَ وَالْمُسْلِمَاتِ وَالْمُؤْمِنِيْنَ

وَالْمُؤْمِنَاتِ وَالْقَنَاتِيْنَ وَالْقَنَاتِ

وَالصُّدِقِيْنَ وَالصُّدِقَاتِ وَالصَّبِيْرِيْنَ

وَالصَّبْرِ وَالْحَشِيعِينَ وَالْحُشْعَتِ

وَالْمُتَصَدِّقِينَ وَالْمُتَصَدِّقَاتِ وَالصَّائِمِينَ

وَالصَّيِّمَاتِ وَالْحَفِظِينَ فُرُوجَهُمْ وَالْحَفِظَاتِ

وَالذَّاكِرِينَ اللَّهَ كَثِيرًا وَالذَّاكِرَاتِ أَعَدَّ اللَّهُ لَهُمْ ۝

مَغْفِرَةً وَأَجْرًا عَظِيمًا ۝ وَأَنْ لَيْسَ لِلْإِنْسَانِ

إِلَّا مَا سَعَى ۝ وَأَنَّ سَعْيَهُ سَوْفَ يُرَى ۝ ثُمَّ

يُجْزَاهُ الْجِزَاءَ الْأَوْفَى ۝ وَأَنَّ إِلَىٰ رَبِّكَ الْمُنْتَهَى ۝

અલ્લાહુમ્મ-સલ્લિ-વ-સલ્લિમ-અલા-
 સચ્ચિદિના-મુહમ્મદિનિલ-બશીરિલ-
 મુબશ્શિરિ-લિલ-મુઅમિનીન-બિમા-કા-
 લલ્લાહુલ-અઝીમ : ઇન્નલ-મુસ્લિમીન-વલ-
 મુસ્લિમાતિ-વલ-મુઅમિનીન-વલ-
 મુઅમિનાતિ-વલ-કાનિતીન-વલ-કાનિતાતિ-
 વસ્સાદિકીન-વસ્સાદિકાતિ-વસ્સાબિરીન-
 વસ્સાબિરાતિ-વલ-ખાશિઈન-વલ-
 ખાશિઆતિ-વલ-મુતસદિકીન-વલ-
 મુતસદિકાતિ-વસ્સાઈમીન-વસ્સાઈમાતિ-
 વલ-હાફિઝીન-ફુરૂજહુમ-વલ-હાફિઝાતિ-
 વખ્ખાફિરીનલ્લાહ-કસીરન-વખ્ખાફિરાતિ-
 અઅદલ્લાહુ-લહુમ-મગ્ફિરતન-વ-અજરન-
 અઝીમા ૦ વ-અલ્લયસ-લિલ-ઈન્સાનિ-
 ઇલ્લા-મા-સઆ ૦ વ-અન્ન-સઅયહુ-સૌફ-
 યુરા ૦ સુમ્મ-યુજ્જાહુલ-જ્જાઅલ-ઓફા ૦
 વ-અન્ન-ઈલા-રબ્બિકલ-મુન્તાહા ૦

तर्जमा

“अै अल्लाह पाक ! हमारै सरदार हउरते सय्यिदुना मुहम्मद ﷺ पर दुरद भेज, जे मोअमिनो को भुश भबरी देने वाले हँ जैसा के अउमत वाले अल्लाह पाक का ँरशाद है के ० “बेशक ! मुसलमान मर्द और मुसलमान औरतें और ँमान वाले और ँमान वालियां और इरमां भरदार और इरमां भरदारीं और सय्ये और सय्यियां और सभ्र वाले और सभ्र वालियां और आजिजी करने वाले और आजिजी करने वालियां और भैरात करने वाले और भैरात करने वालियां और रोजे वाले और रोजे वालियां और अपनी पारसाँ (शर्मगाल) की छिड़ाउत करने वाले और छिड़ाउत करने वालियां और अल्लाह को बहुत याद करने वाले और याद करने वालियां, उन सब के लिये अल्लाह ने बज्शिश और बणा सवाब तय्यार रभा है” ० “और येह के आदमी न पाअेगा, मगर अपनी कोशिश और येह के उस की कोशिश अन्करीब देणी जाअेगी, इर उस का भरपूर बदला दिया जाअेगा और येह के बेशक ! तुम्हारे रब ही की तरफ़ ँन्तिहा है ०”

اَللّٰهُمَّ صَلِّ عَلَيْهِ صَلَاةً تُشْرِحُ بِهَا الصُّدُوْرُ

وَتَهْوُنُ بِهَا الْاُمُوْرُ وَتَنْكَشِفُ بِهَا السُّتُوْرُ

وَسَلِّمْ تَسْلِيْمًا كَثِيْرًا اِذَاءِمًا

إِلَى يَوْمِ الدِّينِ ۝ دَعُوهُمْ فِيهَا سُبْحَانَكَ

اللَّهُمَّ وَتَحِيَّتُهُمْ فِيهَا سَلَامٌ ۝ وَآخِرُ

دَعْوَاهُمْ أَنْ الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ ۝

અલ્લાહુમ્મ-સલ્લિ-અલયાહિ-સલાતન-
તુશ-રિહુ-ખિહસ્સુદૂરુ-વ-તહૂનુ-ખિહલ-ઉમૂરુ-
વ-તન્કશિકુ-ખિહસ્સુતૂરુ-વ-સલ્લિમ-તસ્લીમન-
કસીરન-દાઘમન-ઘલા-યોમિદીન ૦ દઅવાહુમ-
ફીહા-સુહાનકલ્લાહુમ્મ-વ-તહિય્યતુહુમ-ફીહા-
સલામુન-વ-આખિરુ-દઅવાહુમ-અનિલ-હમ્દુ-
લિલ્લાહિ-રઠિખિલ-આલમીન ૦

તર્જમા

“ઐ અલ્લાહ પાક ! તેરે મહબૂબ صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ પર
ઐસા દુરૂદ ભેજ જિસ સે હમારે સીને કુશાદા હો જાએ ઐર
જિસ સે સારે કામ આસાન હો જાએ ઐર જિસ સે પોશીદા બાતેં
ખુલ જાએ ઐર ક્રિયામત તક હમેશા કસરત સે ખૂબ સલામ
ભેજ ૦ “ઉન કી દુઆ ઉસ મેં યેહ હોગી કે ઐ અલ્લાહ ! તુઝે
પાકી હૈ ઐર ઉન કે મિલતે વક્ત ખુશી કા પહલા બોલ સલામ
હૈ ઐર ઉન કી દુઆ કા ખાતિમા યેહ હૈ કે સબ ખૂબિયાં
અલ્લાહ પાક કે લિયે હેં જો રબ હૈ સારે જહાન કા ૦”

دُرُودٌ تُنَجِّينَا

بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ

اللَّهُمَّ صَلِّ عَلَى سَيِّدِنَا مُحَمَّدٍ صَلَاةً
 تُنَجِّينَا بِهَا مِنْ جَمِيعِ الْأَهْوَالِ وَالْأَفَاتِ *
 وَتَقْضِي لَنَا بِهَا جَمِيعَ الْحَاجَاتِ * وَتُطَهِّرُنَا
 بِهَا مِنْ جَمِيعِ السَّيِّئَاتِ * وَتَرْفَعُنَا بِهَا
 عِنْدَكَ أَعْلَى الدَّرَجَاتِ * وَتُبَلِّغُنَا بِهَا أَقْصَى
 الْغَايَاتِ * مِنْ جَمِيعِ الْخَيْرَاتِ * فِي
 الْحَيَاةِ وَبَعْدَ الْمَمَاتِ إِنَّكَ مُجِيبُ الدَّعَوَاتِ وَ
 رَافِعُ الدَّرَجَاتِ وَيَا قَاضِيَ الْحَاجَاتِ وَيَا كَافِيَ
 الْمُهْمَاتِ وَيَا دَافِعَ الْبَلِيَّاتِ وَيَا حَلَّ
 الْمَشْكَلَاتِ اغْنِنِي اغْنِنِي يَا إِلَهِي إِنَّكَ
 عَلَى كُلِّ شَيْءٍ قَدِيرٌ *

દુરૂં વુનજુના

અલ્લાહુમ્મ-સલ્લિ-અલા-સય્યિદિના-
 મુહમ્મદિંવ-વ-અલા-આલિહી-સલાતન-
 વુનજુના-બિહા-મિન-જમીઇલ-અહવાલિ-
 વલ-આફાતિ-વ-તકદી-લના-બિહા-
 જમીઇલ-હાજતિ-વ-તુતહિહરુના-બિહા-
 મિન-જમીઇરસય્યિઆતિ-વ-તર-ફઉના-
 બિહા-ઇન્ક-અલદરજતિ-વ-
 તુબલ્લિગુના-બિહા-અકસલ-ગાયાતિ-
 મિન-જમીઇલ-ખૈરાતિ-ફિલ-હયાતિ-વ-
 બઅદલ-મમાતિ ૦ ઇન્ક-
 મુજુબુદઅવાતિ-વ-રાફિઉદરજતિ-વ-યા-
 કાદિયલ-હાજતિ-વ-યા-કાફિયલ-
 મુહિમ્માતિ-વ-યા-દાફિઅલ-બલિય્યાતિ-વ-
 યા-હલ્લલમુશ્કિલાતિ-અગિરની-
 અગિરની-અગિરની-યા-ઇલાહી-ઇન્ક-
 અલા-ફુલ્લિ-શૈઇન-કદીર ૦

तर्जमा

“अै अल्लाह पाक ! हमारै सरदार हजरते सय्यिदुना मुहम्मद ﷺ और उन की आल पर दुरुद भेज अैसा दुरुद के उस के वसीले से हमें तमाम उर, भौंइ और आइतों से नजात मिल जाअे और जिस की बरकत से हमारी तमाम हाजतें पूरी हो जाअें और जिस के तुईल हम तमाम गुनाहों से पाको साइ हो जाअे और जिस के वसीले से हम तेरी बारगाह में उंये दरजों पर मुतमकिकन हों और जिस के जरीअे हम जिन्दगी की तमाम नेकियों और मरने के बा'द की तमाम अश्याइयों से पूरा इाईदा हासिल कर सकें. अै हमारे रब ! तू ही हमारे दरजात को बुलन्द करने वाला, हमारी हाजतों को पूरा करने वाला, सप्त मुसीबतों में पूरी मदद करने वाला और बलाओं को दइअ (भत्म) करने वाला है ० अै मुश्किलो को हल करने वाले पाक परवर दिगार ! हमारी इरियाद को पहुंय, हमारी पुकार सुन, हमारी अर्ज को कबूल इरमा ० अै हमारे मा'बूद ! बेशक ! तू ही हर चीज पर कादिर है ०”

دُرُودِ تَاجِ

بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ

اللَّهُمَّ صَلِّ عَلَى سَيِّدِنَا وَمَوْلَانَا مُحَمَّدٍ *
 صَاحِبِ التَّاجِ وَالْبِعْرَاجِ وَالْبُرَاقِ وَالْعَلَمِ * دَافِعِ
 الْبَلَاءِ وَالْوَبَاءِ وَالْقَحْطِ وَالْمَرَضِ وَالْأَلَمِ * إِسْمُهُ
 مَكْتُوبٌ مَرْفُوعٌ مَشْفُوعٌ مَنقُوشٌ فِي اللَّوْحِ وَالْقَلَمِ
 * سَيِّدِ الْعَرَبِ وَالْعَجَمِ * جِسْمُهُ مُقَدَّسٌ
 مُعَطَّرٌ مُطَهَّرٌ مُنَوَّرٌ فِي الْبَيْتِ وَالْحَرَمِ * شَمْسِ
 الضُّحَى * بَدْرِ الدُّجَى * صَدْرِ الْعُلَى * نُورِ
 الْهُدَى * كَهْفِ الْوَرَى * مِصْبَاحِ الظُّلَمِ *
 جَبِيلِ الشِّيمِ * شَفِيعِ الْأُمَمِ * صَاحِبِ الْجُودِ
 وَالْكَرَمِ * وَاللَّهِ عَاصِمُهُ * وَجَبْرِيلُ خَادِمُهُ *
 وَالْبُرَاقُ مَرْكَبُهُ * وَالْبِعْرَاجُ سَفَرُهُ *

وَسِدْرَتُ الْمُنْتَهَى مَقَامُهُ * وَقَابِ قَوْسَيْنِ
 مَطْلُوبُهُ * وَالْمَطْلُوبُ مَقْصُودُهُ * وَالْمَقْصُودُ
 مَوْجُودُهُ * سَيِّدِ الْمُرْسَلِينَ * خَاتِمِ النَّبِيِّينَ *
 شَفِيعِ الْمُدْنِيِّينَ * أُنَيْسِ الْغُرَبِيِّينَ * رَحْمَةِ
 لِّلْعَالَمِينَ * رَاحَةِ الْعَاشِقِينَ * مُرَادِ الْمُشْتَاقِينَ
 * شَمْسِ الْعَارِفِينَ * سِرَاجِ السَّالِكِينَ *
 مُصْبِحِ الْمُقَرَّبِينَ * مُحِبِّ الْفُقَرَاءِ وَالْغُرَبَاءِ
 وَالْمَسَاكِينِ * سَيِّدِ الثَّقَلَيْنِ * نَبِيِّ الْحَرَمَيْنِ *
 إِمَامِ الْقِبْلَتَيْنِ * وَسَيِّدِنَا فِي الدَّارَيْنِ * صَاحِبِ
 قَابِ قَوْسَيْنِ * مَحْبُوبِ رَبِّ الْمَشْرِقَيْنِ وَالْمَغْرِبَيْنِ
 * جَدِّ الْحَسَنِ وَالْحُسَيْنِ * مَوْلَانَا وَمَوْلَى الثَّقَلَيْنِ
 * أَبِي الْقَاسِمِ مُحَمَّدِ بْنِ عَبْدِ اللَّهِ * نُورٍ مِّنْ نُورِ
 اللَّهِ * يَا أَيُّهَا الْمُشْتَاقُونَ بِنُورِ جَمَالِهِ * صَلُّوا عَلَيْهِ
 وَآلِهِ وَأَصْحَابِهِ وَسَلِّمُوا تَسْلِيمًا *

દુરૂદ તાજ

અલ્લાહુમ્મ-સલ્લિ-અલા-સચ્ચિદના-
 વ-મૌલાના-મુહમ્મદીન સાહિબિતાજિ-વલ-
 મેઅરાજિ-વલ-બુરાકિ-વલ-અલમિ ૦
 દાફિઈલ-બલાઈ-વલ-વબાઈ-વલ-કહતિ-
 વલ-મરદિ-વલ-અલમિ ૦ ઇસ્મુહૂ-
 મકતુબુમ- મરફૂઉમ-મરફૂઉમ-મનફૂશુન-
 ફિલ્લૌહિ-વલ-કલમ ૦ સચ્ચિદિલ-અરબિ-
 વલ-અજમ જિસ્મુહૂ-મુકદ્દસૂમુઅતરુમ-
 મુતહ્હરુમ-મુનવ્વરુન-ફિલ-બયતિ-વલ-
 હરમ ૦ શમ્સિદ-દુહા-બદરિદ-દુબા-
 સદરિલ-ઉલા-નૂરિલ-હુદા-કહફિલ-વરા
 મિસ્બાહિમ્-મુલમ-જમીલિશિયમ-
 શફીઈલ-ઉમમ ૦ સાહિબિલજુદિ-વલ-કરમ
 ૦ વલ્લાહુ-આસિમુહૂ ૦ વ-જિબ્બીલુ-
 ખાદિમુહૂ. વલ-બુરાકુ-મરકબુહૂ ૦ વલ-
 મેઅરાજુ-સફરુહૂ ૦ વ-સિદરતુલ-મુન્તહા-
 મકામુહૂ ૦ વ-કાબ-કૌસયનિ-મતલૂબુહૂ ૦
 વલ-મતલુબુ-મકસુદુહૂ ૦ વલ-મકસુદુ-

મોજુદુદ્દ, સચ્ચિદિલ-મુરસલીન ૦
 ખાતિમિન્નબિચ્ચીન ૦ શફીઘલ-
 મુઝનિબીન અનીસિલ-ગરીબીન ૦
 રહમતલિલ-આલમીન ૦ રાહતિલ-
 આશિકીન મુરાદિલ-મુશ્તાકીન ૦
 શમ્સિલ-આરિફીન ૦ સિરાજિસ્સાલિકીન
 ૦ મિસ્બાહિલ-મુકર્રબીન ૦ મુહિબ્બિલ-
 કુકરાઈ-વલ-ગુરબાઈ-વલ-મસાકીન ૦
 સચ્ચિદિસ્સકલૈન ૦ નબિચ્ચિલ-હરમૈન ૦
 ઘમામિલ-કિબ્લતૈન ૦ વસીલતિના-
 ફિદ્દારૈન ૦ સાહિબિ-કાબ-કૌસૈન ૦
 મહબૂબે-રબ્બિલ મશરિકૈનિ-વલ-
 મગરિબૈનિ-જદિલ-હસનિ-વલ-હુસૈનિ-
 મૌલાના-વ- મૌલસ્સકલૈનિ-અબિલ-
 કાસિમિ-મુહમ્મદિબ્નિ-અબ્દિલ્લાહિ-નૂરિમ-
 મિન નૂરિલ્લાહિ ૦ યા-અચ્ચુહલ-
 મુશ્તાફૂનબિનૂરિ-જમાલિહી-સલ્લુ-અલેહિ-
 વ આલિહી-વ-અસ્હાબિહી-વ-સલ્લિમૂ-
 તસ્લીમા ૦

तर्जमा

“अै अल्लाह पाक ! हमारै आका व भौला हजरते मुहम्मद صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ पर दुइद भेज, जो ताज वाले, मे'राज वाले, बुराक वाले और अलम वाले हें ० जो बला, वभा, कहत, भीमारी और रंजो गम को दूर करने वाले हें ० जिन का मुबारक नाम लौडे मडकूज और कलम में लिखा हुवा, बुलन्द किया हुवा जणा हुवा और नकश किया हुवा है ० जो अरब और अजम के सरदार हें ० जिन का जिस्मे पाक का'बा शरीफ और हरम शरीफ में पाक, पुशबूदार, पाक करने वाला और रौशन है ० जो याशत (सुब्हा) के आइताब, यौदहवीं रात के यमकते यांद हें ० जो बुलन्दी के सदर, डिदायत के नूर, मज्लूक को पनाह देने वाले, अन्धेरो के यराग, अखी आदत वाले, तमाम उम्मतों की शफाअत करने वाले और नवाजिशो करम वाले हें ० और अल्लाह तआला उन की डिफाजत इरमाने वाला है और जिब्रिल عَلَيْهِ السَّلَام उन के फादिम हें और बुराक उन की सुवारी है ० और मे'राज उन का सइर है और सिदरतुल मुन्तहा उन का मकाम है ० और का'बा कौसैन (कुर्बे ईलाही) उन का मत्वूब है और मत्वूब उन का मकसूद है और मकसूद उन का भौजूद है ० जो तमाम रसूलों के रसूल और तमाम नबियों के फातिम (आबिरी) हें ० जो गुनहगारों की

शङ्कात करने वाले, गरीबों के मददगार और तमाम जहानों के लिये रहमत हैं ० जो आशिकों की राहत, मुश्ताकों की मुराद, आरिफों के लिये आइताब, अल्लाह की राह में चलने वालों के लिये बिराग और मुकर्रबीन के लिये रौशन शम्न हैं ० जो इकीरों, गरीबों, भिस्कीनों से महब्बत करने वाले हैं ० जो दोनों जहान के सरदार जो दोनों डिब्लों के इमाम हैं ० जो दुन्या और उक्बा (आभिरत) में हमारा वसीला हैं ० जो का'बा कौसैन की शाने आली वाले और दोनों मशिकों और मग़िबों के रब के महबूब हैं ० जो हजरते इमामे हसन और इमामे हुसैन رَضِيَ اللهُ تَعَالَى عَنْهُمَا के नानाजान, हमारे आका और दोनों जहान के वाली हैं यानी अबिल कासिम हजरते मुहम्मद صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ जो हजरते अब्दुल्लाह رَضِيَ اللهُ تَعَالَى عَنْهُ के शहजादे और अल्लाह के नूर से नूर हैं ० अै उन के जमाले जहान आरा के दीदार का शौक रहने वालो ! उन पर उन की आल पर और उन के अस्हाब पर दुइद भेजो और सलाम अर्ज करो, जैसा के सलाम अर्ज करने का हक है ०”



या साहिबल-जमालि व या सय्यिदल-भशर
मिंय वज्हिङ्कल-मुनीरि ल-ङ्ग् नप्परल-कमर
ला युम्किनुस्सनाठि कमा का-न हङ्कुहु
भअद अग् पुदा बुगुर्ग तूँ किरसा मुप्तसर


“अय साहिबे जमाल और अय एन्सानोंके सरदार
आपके रुपे अन्परसे चाँद यमक उठा
आपकी सना का हक अदा करना मुम्किन ही नहीं
किरसा मुप्तसर येह के, पुदाके बाद आप ही बुगुर्ग हैं.”

- अल्लामा अब्दुरहमान जमी

भ-ल-गल-उला मि-कमालिही
क-श-ङ्ग् दुजा मि-जमालिही
हसुनत् जमीठि भिसालिही
सल्लू अलैहि व आलिही

“वोह पहंचे बुलन्दीयों पर अपने कमालके साथ
आपके जमालसे तमाम अंधेरे दूर हो गये
आपकी तमाम आदतें ही अरछी हैं
आप पर और आपकी आल पर लाजों दुइदो सलाम”

- अल्लामा शौभ सअदी



मिशन का मकसद डोम की ज़िम्मेदारी



हजार بار بشویم دهن به مشک و گلاب
هنوز نام تو گفتن کمال بے ادبیست

“हजार बार अ-शोयम दहन ऋ मुश्को गुलाब
हनूळ नामे तू गुहृतन क्माले जे-अदबी अस्त”

“हजार बार भी अगर अपना मुँह मुश्को
अर्के गुलाबसे धोऊं, फिर भी आपका
पाकीज़ा नाम लेना
जहुत जणी जे-अदबी समझता हूँ.”

- अब्बामा अब्दुरहमान जामी